

પ્રસાર ભારતી
ભારતનું લોકસેવા પ્રસારક
સમાચાર વિભાગ, દૂરદર્શન, અમદાવાદ

અગત્યની જાહેરાત

અમદાવાદના દૂરદર્શન કેન્દ્રમાં કાર્યરત સમાચાર વિભાગમાં કામચલાઉ ધોરણે નીચેના પદ માટે કેઝ્યુઅલ પ્રતિક્ષાયાદી તૈયાર કરવાની હોવાથી ભારતનું લોકસેવા પ્રસારક, પ્રસારભારતીના ગુજરાતી ચેનલ - ડીડી ગિરનાર સાથે સંકળાવા માંગતા ઉમેદવારોને અરજી મોકલવા આમંત્રણ છે.

1. આસિસ્ટન્ટ ન્યૂઝ એડિટર/કોપી એડિટર
2. વેબસાઇટ આસિસ્ટન્ટ
3. પોસ્ટ પ્રોડક્શન આસિસ્ટન્ટ (એડિટીંગ)
4. સી.જી.ઓપરેટર

અરજીદાતા માટે લાયકાત અને અનુભવની વિગત નીચે મુજબ છે.

(1) આસિસ્ટન્ટ ન્યૂઝ એડિટર/કોપી એડિટર (ઉ.વ.25-50 વર્ષ)

અનિવાર્ય લાયકાત

1. માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક પદવી
2. માન્ય યુનિવર્સિટી તરફથી પત્રકારિત્વમાં ડિગ્રી ડિપ્લોમા
3. ટીવી સમાચાર તથા અખબારમાં ત્રણ વર્ષનો અનુભવ

ઈચ્છનીય લાયકાત

1. ગુજરાત સહિત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના સાંપ્રત પ્રવાહોની જાણકારી
2. મેટ્રીકમાં ગુજરાતી વિષય અનિવાર્ય
3. કોમ્પ્યુટર તથા ઇન્ટરનેટનું જ્ઞાન તથા હિંદી અંગ્રેજીમાં તેનો ઉપયોગ કરવાની ક્ષમતા

2. વેબસાઇટ આસિસ્ટન્ટ (ઉંમર 25થી 50 વર્ષ)

અનિવાર્ય લાયકાત

- (1) માન્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતક પદવી
- (2) માન્ય યુનિવર્સિટી દ્વારા પત્રકારિત્વમાં ડિગ્રી/ ડિપ્લોમા

ઈચ્છનીય લાયકાત

- (1) સમાચાર સંસ્થામાં ન્યૂઝ વેબસાઇટ માટેની સામગ્રી તૈયાર કરવાનો બે વર્ષનો અનુભવ
- (2) સમાચાર એકત્રિકરણથી માંડી પ્રસારણ સુધીના તમામ તબક્કે થતી કામગીરીની જાણકારી તથા પ્રકૃતિદત કે અનુભવદત સમાચાર સૂઝનો ગુણ
- (3) હિંદી અંગ્રેજી ભાષાના જ્ઞાન સાથે કોમ્પ્યુટર/ઇન્ટરનેટ વિશે આવડત અને અનુભવ

3. પોસ્ટ પ્રોડક્શન આસિસ્ટન્ટ (એડિટીંગ) (ઉંમર 21 થી 50)

અનિવાર્ય લાયકાત

- (1) માન્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતક પદવી
- (2) માન્ય યુનિવર્સિટી દ્વારા ફિલ્મ / વિડિયો એડિટીંગમાં ડિગ્રી/ ડિપ્લોમા

ઈચ્છનીય લાયકાત:

- (1) મેટ્રીકમાં સ્થાનિક ભાષા વિષય જોઈએ.
- (2) ઓડિયો વિઝ્યુઅલ મીડિયમ અંગે આવડત અને સૂઝ

4. સી.જી. ઓપરેટર (ઉંમર 21 થી 50 વર્ષ)

અનિવાર્ય લાયકાત

- 1) 10+ 2 માન્ય બોર્ડ દ્વારા
- 2) કોમ્પ્યુટર સંચાલનમાં સર્ટિફિકેટ
- 3) કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપીંગની સારી ઝડપ

ઈચ્છનીય લાયકાત

કોમ્પ્યુટર ટાઇપીંગમાં ગુજરાતી ભાષા માટેનું માન્ય સંસ્થાનું સર્ટિફિકેટ
અખબાર, ટી.વી. ચેનલ તથા વેબમાં સમાચાર સામગ્રી ટાઇપ કરવાનો એક વર્ષનો અનુભવ

અરજી કરવા વિશે માહિતી

- 1) અમદાવાદ, ગાંધીનગરમાં વસવાટ કરતાં ઉમેદવારો પાસેથી અરજી આવકાર્ય છે.
અરજી કરવાનું ફોર્મ અહીંથી ડાઉનલોડ કરો.
- 2) અરજીદાતાએ પોતાની અરજી આ પ્રમાણે કરવી

'ડાયરેક્ટર, સમાચાર વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ, અમદાવાદ - 380054'

- 3) ક્વર ઉપર સ્પષ્ટ અક્ષરે કઈ કેટેગરી માટે અરજી પાઠવી છે તે લખવું.
- 4) એકથી વધુ કેટેગરી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ પોતાની અરજીમાં આ બાબત સ્પષ્ટ રીતે નોંધવી.
- 5) છેલ્લી તારીખ - 25-9-2017